

આદિવાસી સંશોધન -વ-તાલીમ કેન્દ્ર, આકૃયુ, દેવગઢ બારીયા અને વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ દ્વારા ખેડૂતોને “સજીવ ખેતી” વિશે તાલીમ આપવામાં આવી

સમગ્ર દેશમાં કોરના વાયરસ (Corona virus)ના કારને લોકડાઉન (Lockdown)ની સ્થિતિ છે ત્યારે દેશના શહેરોમાં હવાની ગુણવત્તા સુધરી છે. નદીઓના પાણી પણ શુદ્ધ થયું છે. લોકો ઘરોમાં રોકાયેલા છે જ્યારે પશુઓ, પક્ષીઓનો કલરવ ચારેકોર સંભળાય છે. જાણે કે કુદરતને નવું જીવન મળ્યું છે. લોકો પ્રકૃતિને પ્રેમ કરતા થાય અને અને પોતે પણ આણંદ મેળવે એવી સજીવ ખેતી વિષય પર આદિવાસી સંશોધન-વ-તાલીમ કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દેવગઢ બારીયા અને વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદના સંયુક્ત ઉપક્રમે આદિવાસી મહિલા ખેડૂત કેન્દ્ર ખાતે તા. ૨૫/૦૬/૨૦૨૦ના રોજ ગરબાડા તાલુકાના ખેડૂતોને એક દિવસીય તાલીમ આપવામાં આવી.

ડૉ. જી. જી. પટેલ યુનિટ અધિકારીશ્રી, ટીઆરટીસી ટે'બારિયા દ્વારા આણંદથી આવેલા વૈજ્ઞાનિકશ્રીઓ અને ખેડૂતોનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. તેઓને કોરોના વાયરસની મહામારમાં રાજ્ય સરકાર દ્વારા અપાયેલ માર્ગદર્શિકાઓનું પાલન કરી તાલીમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું જાળવવું તેની કાળજી લેવા કહ્યું. તેઓએ જમીનની ફળદ્રુપતા જાળવવા લીલો પડવાશની રીતો, લીલો પડવાશ માટે કઠોળ અને બિન કઠોળ વર્ગના પાકો તેમજ પાકની પસંદગીમાં ધ્યાનમાં રાખવાના બાબતોથી લીલો પડવાશ વિશે સવિસ્તર માહિતી અને ખેતીકાર્યોમાં ખર્ચ ઘટાળી આવક બમણી કરવા મુખ્ય બાબતો જણાવી.

તાલીમ કાર્યક્રમના મુખ્ય અતીથી, ડૉ. એમ. વી. પટેલ આચાર્યશ્રી, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુવનિવર્સિટી, આણંદ ઉપસ્થિત સજીવ ખેતીની અગત્યતાથી તાલીમાર્થીઓને માહિતગાર કરી તેઓનો ઉત્સાહ વધાર્યો હતો. વધુમાં, તેઓએ જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મો, જમીનની ભેજ સંગ્રહ શક્તિ અને પીએચ વગેરેની માહિતી આપતા જમીનમાં રહેલા ફાયદાકારક સુક્ષ્મ જીવાણુઓની ક્રિયાશીલતા વધારવા અને છોડના વિકાસ માટે જરૂરી પોષક તત્વોના સમતોલન માટે જમીનમાં મોટા પાયે વપરાતા કમ્પોસ્ટ અને છાણિયુ ખાતર અને વિવિધ ખોળના ઉપયોગો અને મહત્વથી માહિતગાર કર્યા હતા.

ખેડૂત શ્રી.દિલીપભાઈ ધાંગા, આણંદ કૃષિ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય અને દાહોદ જીલ્લાના પ્રગતીશિલ ખેડૂતે, તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી, કૃષિ યુનિવર્સિટીના

વૈજ્ઞાનિકો દ્વારા આપવામા આવેલ ખેડૂત ઉપયોગી ભલામણોનોની ખેતીમાં અમલવારી કરવા ખેડૂતોને પ્રોત્સાહીત કરેલ હતા.

ડૉ. આર. જી. પરમાર, સહપ્રાધ્યાપક અને વડા વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદએ સજીવ ખેતીમાં જૈવિક ખાતરોનો ફાળો તેમજ વર્મિકમ્પોસ્ટ બનાવવાની પદ્ધતિનું માર્ગદર્શન પુરૂ પાડેલ હતું. અત્રેની કચેરીના તાલીમ સહાયક, ડૉ. પી. એચ. ગોધાણી દ્વારા ચોમાસુ પાકોમાં બિનરાસાયણીક પદ્ધતી દ્વારા જીવાતોનું નિયંત્રણ કરવા ખેડૂતોને માર્ગદર્શન આપેલ.

ડૉ. ગુંણવત એન. થોરાત (મદદનીશ પ્રાધ્યાપક) પીવીકે, ટીઆરટીસી, આકૃયુ., દ્વારા સજીવ ખેતીમાં પશુપાલનના મહત્વ વિશે સમજાવ્યું. આ તાલીમ કાર્યક્રમમાં ડૉ. વી. આર. ગોહિલ (સહ પ્રાધ્યાપક), શ્રી.એ. પી. સાવલિયા (ખેતી અધિકારી), ડૉ.અનિકેત મકાણી (રીસર્ચ એસોસિયેટ), ડૉ. એકતા પંડ્યા (રીસર્ચ એસોસિયેટ) અને શ્રી. જે. એમ. પટેલ (પશુધન નિરિક્ષક) હાજરી આપી તાલીમ કાર્યક્રમ સફળ બનાવવા પ્રયત્ન કર્યા હતા. સમગ્ર તાલીમનું સંચાલન ડૉ. જી, જે. પટેલ, યુનિટ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ડૉ. ગુંણવત એન. થોરાત દ્વારા કરવામાં આવેલ હતું.





# "सञ्च भेती" विशे तालीम

स्थान: आदिवासी महिला भेदूत तालीम केन्द्र, टीआरटीसी, आकृयु, देवगढ बारीया., ता. २५.०९.२०२०

